https://archive.org/details/bk662/page/n0/mode/1up

1925 Around -Pavitra Veddharmano Prakash Ane Pirana Satapanthna Pakhand (662)

All Items on https://archive.org/details/@realpatidar

Full Library on https://realpatidar.com/library

" सत्यान्नास्ति परो धर्मः। "

પવિત્ર વેદધર્મનો પ્રકાશ;

અને

પીરાણા સતપંથનાં પાખંડ!

સૈયદ બાવાસાહેબ અહેમદઅલિ ખાકી

ના

પ્રેમ ઉદ્ગારનો સ્નેહ-સત્કાર!

તથા

સત્યશોધક ધર્મબંધુઓને વિજયમાળ!

" धर्मस्य त्वरिता गतिः ॥ "

લેખક અને પ્રકાશક—
પટેલ નારાયણજી રામજીભાઇ કોન્ટ્રેક્ટર,
(કચ્છ વીરાણીવાળા) હાલ ઘાટકોપર (થાણા)

મૂલ્ય—
નિષ્પક્ષપાત ન્યાય અને સત્યનું શોધન

સુરત બરાનપુરી ભાગળ ઉપર આવેલા શ્રી અનાવિલબંધુ
પ્રીન્ટીંગ પ્રેસમાં ગોવિંદજી ડાહ્યાભાઇ નાયકે છાપ્યું.

realpatidar.com

https://archive.org/details/bk662/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 2, 3, 4, 5, 8, 12.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v5.py

https://archive.org/details/bk662/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.19 13:17:45 +05'30'

Real Patidar
Unravel Truth

"सत्यान्नास्ति परो धर्मः।"

પવિત્ર વેદધર્મનો પ્રકાશ;

અને

પીરાણા સતપંથનાં પાખંડ!

સૈયદ બાવાસાહેબ અહેમદઅલિ ખાકી

ના

પ્રેમ-ઉદ્ગારનો સ્નેહ-સત્કાર!

તથા

સત્યશોધક ધર્મબંધુઓને વિજયમાળ!

"धर्मस्य त्वरिता गतिः ॥"

લેખક અને પ્રકાશક—
પટેલ નારાયણજી રામજીભાઇ કોન્ટ્રૅક્ટર,
(કચ્છ વીરાણીવાળા) હાલ ઘાટકોપર (થાણા)

મૂલ્ય—
નિષ્પક્ષપાત ન્યાય અને સત્યનું શોધન

સુરત બરાનપુરી ભાગળ ઉપર આવેલા શ્રી અનાવિલબંધુ
પ્રીન્ટીંગ પ્રેસમાં ગોવિંદજી ડાહ્યાભાઇ નાયકે છાપ્યું.

https://archive.org/details/bk662/page/n3/mode/1up

realpatidar.com

સઘળા સત્યશોધક અને સત્યપ્રેમી સજ્જનોને—

આ ઉલ્લેખનું ઉદ્દેશદર્શક નિવેદન.

૧૨૨૮

પૂજ્ય સ્વધર્માભિમાની આર્યબન્ધુઓ! ઇશ્વરી ' સત્ય ' ને ચાહનારા સજ્જનો ' તથા વ્હાલા '—ની કડવા પાટીદાર ભાઇઓ '

આ ચર્ચાત્મક લેખ આપની સેવામા હાજર કરતી વખતે, આપ સર્વને સવિનય નિવેદન કરવાનુ કે, પરમકૃપાળુ પરમાત્મા અને પવિત્ર માતાજી ગ ગાજીને પ્રતાપેજ આ બરાબર વખતસરની ચર્ચા ઉભી થઇ છે, માતા ગ ગાજીની કૃપાથીજ બનાવટી ગ ગાનુ નવુ પાખ ડ ઉભુ કરવાનો પીરાણા સતપથી કાર્યવાહકોને ધ્હાનો મ્હડી આવ્યો છે ' કહેવત છે કે, ઘો જ્યારે મરવાની થાય ત્યારેજ વાઘરી વાડે જાય છે ' અને માણસ જ્યારે મોતની નજીક આવે ત્યારેજ તેની બુદ્ધિ બગડી જાય છે ' બીજી કહેવત છે કે, " વિનાશકાળે વિપરિત બુદ્ધિ !" એ ન્યાયે પીરાણાના પુન્યો પરવારેલાં હોવાથી તેમને આવુ એક હડહડતુ પાખ ડ ઉભુ કરવાનો હાલ ઉભરો મ્હડી આવ્યો છે ! એ પાખ ડી પીરાણા " સતપ થ " ની જાળમા અજ્ઞાન કે અ ધશ્રદ્ધાથીજ પૂર્વના પાપે ફસાઈ ગયેલા બિચારા ભોળા હિ દુભાઇઓને જાગૃત કરવા માટે, અને પવિત્ર હિ દુજનતાને એ છ દ–પાશમાથી છોડાવવા માટેજ કલિમહારાજે એ પાખ ડીઓને કુબુદ્ધિ સુઝાડેલી જણાય છે એથીજ આજે સત્યધર્મ તેમજ સત્ય કર્મને શોધવા તેમજ ઓળખી લેવાનો, લાગતા વળગતા સર્વ ભાઇઓને આ ઉત્તમ પ્રસ ગ અને સોનેરી સમય પ્રાપ્ત થયો છે પરમાત્મા આપણુ સર્વને તેનો લાભ લેઇ લેવાની સુબુદ્ધિ આપો—

વિશેષ અમારી ખાત્રી છે કે આ મહત્વની ચર્ચાથી પ્રપ ચીઓના પાપ અને પીરાણાના પોગળ પ્રકાશમા આવશે, અને કાવત્રા બાજોની કપટજાળમાથી અમારા ઉદાર અને ભલા–ભોળા કડવા પાટીદાર બન્ધુઓ હમેશને માટે છૂટા થશે અમારી એ માન્યતા પ્રમાણે જો આ પ્રયત્નથી અમારી જ્ઞાતિ એ મહાપાતકમાથી મુક્ત થશે, તો આપણુ સૌને હજારો ગાય છોડાવ્યાનુ અને પવિત્ર હિ દુ ધર્મનુ વખતસર રક્ષણુ કરવાનુ મહાન્ પુણ્ય પ્રાપ્ત થશે

આ વખતે મ્હારે તો એ પ્રપચી લોકોનો પણુ ખાસ આભાર માનવો જોઇએ, કે જેમણે પીરાણામા ગ ગાજી પ્રગટ થવાની ગપથી આ અમૂલ્ય પ્રસ ગ અમને મેળવી દીધો છે, અને દયાળુ પરમાત્મા પણુ જે કઇ કરે છે, તે જગતના કલ્યાણુ માટે તેમજ અજ્ઞાન લોકોને સત્ય સમજાવવા માટેજ કરે છે–એટલે આ ચર્ચાનો વિષય અમને તો આજે અહોભાગ્યથીજ પ્રાપ્ત થયો હોય, એમ લાગે છે–

અને આપ સર્વ આત્મબન્ધુઓને પણુ શરૂઆતમા મ્હારી નમ્રતાપૂર્વક ખાસ વિન તી છે કે, હિંદુ જાતિની આ મહાન્ સેવાના તેમજ અમારી વિશાળ કડવા પાટીદાર જ્ઞાતિના ઉદ્ધારના આ મહત્વના સવાલની રસભરી ચર્ચામા આપ સર્વ ભાઇઓ પણુ રસપૂર્વક ભાગ લઇને ધર્મ–સેવાનો અને આત્મ-કલ્યાણુનો મહાન્ લાભ ઉઠાવો, તેમજ આ ચર્ચા સબ ધી આપમાથી કોઇને જે કઇ શ કા રહેતી હોય, કે સૂચના આપવી યોગ્ય જણુાતી હોય, તે શુદ્ધ હૃદયથી મને આપીને આ ધર્મ અને જ્ઞાતિ સેવકને આભારી કરશોજી

હુ છુ આપ સર્વનો શુભચિન્તક સેવક,

realpatidar.com

પટેલ નારાયણજી રામજીભાઈ કોન્ટ્રેક્ટર

(કચ્છવીરાણીવાળા)–ઘાટકોપર

https://archive.org/details/bk662/page/n4/mode/1up

realpatidar.com

પવિત્ર વેદધર્મના ખરા વિરોધી કોણ ?

અને

"સતપંથ" નામધારી બનાવટી વેદધર્મનો પોગળપ્રકાશ !

પીરાણા "સતપંથ" માં છુપાએલુ હલાહલ ઝેર !

આ લેખ બરાબર ધ્યાનપૂર્વક વાચવાથી આપને સ્પષ્ટ સમજાશે કે,—બાવા ઇમામશાહે ચલાવેલો, પીરાણા સતપથ, એજ સાચો વેદ ધર્મ હોય, એવો ખોટો ડોળ ઘાલીને એ કબ્રસ્તાની મામદા હિંદુ પથવાળા કેટલાક સૈયદો અને કાકાઓ વગેરે અર્ધદગ્ધ લોકો, ભોળા હિંદુઓને કેવી રીતે ઠગે છે, વટલાવે છે અને ઉંધે માર્ગે દોરી જાય છે, તેની અનેક વખત વિસ્તારથી પ્રપચ પોલો ઉઘાડીને, અમે કેટલાક લેખો અને પુસ્તકો આજ સુધી પ્રકટ કર્યા છે, માત્ર એટલુજ નહી પણ એ પ્રપચી પથ, જો ખરો વેદધર્મ કે હિંદુધર્મ છે, એવુ તેઓમાનો કોઇ સાબિત કરી આપે, તો તેને રૂ ૧૦૦૦૦) દશ હજારનુ ઇનામ આપવાની અમે જાહેર પત્રોમા ચેલેન્જ કરેલી છે છતા પણ એ પથનો કોઇ પણ કાધીયો પોતાની સચ્ચાઇ પૂરવાર કરવાને આજસુધી બહાર આવ્યો નથી. એજ સાબિત કરી આપે છે કે, ખોટા ડોળઘાલુના જુઠાણા તેમજ ભોળા લોકોને ઠગવાની ઉંડી લુચ્ચાઇ ભરેલા ધતીગો સીવાય, એ ખીચડીયા પથમા બીજુ કઇજ સત્ય તત્વ નથી–

કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ બંધુઓને એક નમ્ર અરજ.

આ બધી હકીકત જગજાહેર હોવા છતા, હજુ પણ મારા કેટલાક કચ્છી કડવા પાટીદાર બંધુઓની આંખો ઉઘડતી નથી અને એ પાખડી પથના પાપી પાસલામાથી તેઓ છેકજ છૂટા થઇ શકતા નથી એ જોઇને મારા જેવા એક જ્ઞાતિ–માતાની લાગણીવાળાના હૃદયમા કેવો દાહ થતો હશે, તે એક પરમાત્માજ જાણે છે–મને અફસોસ તો એટલોજ થાય છે, કે અમારા ઘણા સમજુ કડવા પાટીદાર બંધુઓ, જેઓ કચ્છ બહાર વસે છે, સુધરેલી સમાજના જાહેર જીવનમા પણ પોતાની ફરજ સમજી રસપૂર્વક ભાગ લે છે, અને એ પ્રપચી પાપી પથની કપટકળાને પૂરેપૂરી જાણી ગયા છે, તેઓમાના કેટલાક પણ હજુસુધી પોતાની જાહેર હિમ્મત બતાવીને, એ મેલડીના વળગાડમાથી મુક્તિ મેળવી શકતા નથી તેઓ એમ માને છે કે, નાત સાથેજ રહીને અમે ધીરે ધીરે સુધારો કરતા જઇશુ, અને ક્રમે ક્રમે આપણા પવિત્ર ધર્મક્ષેત્રમા પ્રવેશ કરશુ–પણ તેમને ભાન નથી કે, આવી શિથિલતા અને મોળાપણાથી તો આપણા હૃદયનો ધાર્મિક જુસ્સો કાળે કરીને મરી જાય છે, અને આપણી સખ્યામાથી પણ આશાભર્યા અનેક જીવડાઓ ખપી જતાં, કળકળતાં કાળજાંની ખરી દાઝ અને કાળજીવાળા સમજુ કાર્યકર્તાઓ દિવસે દિવસે ઓછા થતા જાય છે. માત્ર એટલુજ-નહી, પણ આપણી બેદરકારી અને ઢીલનો લાભ લઇને, એ પ્રપચી સતપથના કુટિલ ધ્વજીઆઓ પોતાના દાવપેચ અને કાવાદાવા આગળ વધારતાજ જાય છે અને પોતાની જાળમા ભોળા

realpatidar.com

https://archive.org/details/bk662/page/n5/mode/1up

realpatidar.com

હિંદુ સેવકોને વધારે મજબુત રીતે જકડી રાખવાની અનેક છળભેદભરી યુક્તિઓ કરતાજ રહ્યા છે બનાવટી ચમત્કારો બતાવીને, બેહેસ્તની ખોટી લાલચો આપીને, તેમજ જાહેર કે આડકતરી રીતે લાંચ–રુશ્વત વડે દેશના ગદ્દેગ અને મુખી લોકોની મારફતે દબાણ ચલાવીને, **તેઓ પોતાના હાલ દિવસે દિવસે તુટવા લાગેલા આકડાના માંડવાને–સડેલા વાંસના તકલાદી ટેકાઓ આપી રહ્યા છે.**

"સતપંથ"નો શયતાની જુલમ !

એ બધુ ઉપર જણાવેલા સમજુ અને સુધરેલા કડવા પાટીદારો હજી સુધી આંખો સ્હામે જોઇ અને સહી રહ્યા છે, એ કેટલી બધી અફસોસની વાત છે ? અરે ! બંધુઓ ! તમારી ધર્મભાવના, તમારી લાગણી, તમારા વચનો અને તમારા નિશ્ચયનુ બળ ક્યા ગયુ ? તમે આ ઠગાઈ અને જુલમ હજી કેમ સહન કરી રહ્યા છો ? તમે દેશમા જાઓ, ત્યારે એ ઢોંગી અને પાખંડીઓ તમારી પાસેથી ટેક્સ અને લાગાનો દંડ લીધા વિના, તેમજ તમને તન–મનથી ભ્રષ્ટ કરનારી ગટરના ગંદવાડ જેવી, મલીન અને ગંધાતી અમીની ગોળી (!) પીવરાવ્યા વિના, સગા–કુટુંબ, માબાપ, ભાઇ બ્હેન, કે ઘરની સ્ત્રી અને બાળબચ્ચાઓ સાથે પણ તમને મળવા દેતા નથી ! આવો પશુઓ પણ ન વેઠી શકે, એવો ત્રાસ તેઓ વર્તાવી રહ્યા છે, અને તમે તે મુંગે મ્હોડે વેઠી રહ્યા છો, એ કેવી દુ:ખની વાત છે ?

એટલુંજ નહી પણ જે પવિત્ર વેદનુ નામ દેવાનો શુદ્રોને સુદ્ધા અધિકાર નથી, એ વેદની જગજાહેર રીતે ઠઠ્ઠા–મશ્કરીઓ કરીને, વેદને નામે મુસલમાની કલમા અને દુવાનુ કલ્પિત કચુંબર પઢાવે છે, સતપંથની સંધ્યા, સતપંથના યજ્ઞ, હોમ, ગાયત્રી, જપ વગેરે વગેરે હડહડતા જુઠાણા ચિતરી કહાડી, તેમને ધર્મવિધિ અને ધર્મપુસ્તકો તરીકે ઘુસાડી દે છે, અને **ઘટ–પાટ તેમજ એવીજ બીજી કપોળકલ્પિત કુટિલ ક્રિયાઓ કરાવી, નિર્લજ નફટાઇથી આપણને પણ નકટા બનાવીને, જગતની હાસી અને નિંદાને પાત્ર ઠરાવે છે;** જેથી એ પ્રપંચી સતપંથ પાળવા માટે આપણા સુધારક ભાઇઓ પણ ઠામ ઠામ હડધૂત થાય છે અને બીજી બધી હિંદુકોમોના અપમાન તેમજ તિરસ્કારની જ્યા જ્યા જાય ત્યા પડતાલ સહન કરી રહ્યા છે, એ શુ ઓછી શરમની કે અફસોસની વાત છે ? ચેતો, ચેતો, વ્હાલા બંધુઓ ! એ મહાપાપની ફાંસીમાથી હવે તો પ્રભુની ખાતર અને જ્ઞાતિમાતા તથા દેશના હિતની ખાતર છૂટા થાઓ

આપેલા પવિત્ર વચનોની યાદી.

બંધુ ! પરિષદ વચ્ચે તેમજ અનેક મિત્રો અને ભાઇઓની સામે તમે કરેલી પ્રતિજ્ઞાઓ પાળી બતાવી, પવિત્ર પાટીદાર જ્ઞાતિનુ હવે તો પાણી રાખો. વ્હાલા ભાઇઓ ! એકવાર યાદ કરો, સભાસદ થતી વખતે તેમજ જાહેરમા ભાષણો કરતી વખતે, તમે હૃદયની ખરી લાગણી બતાવીને, અમુક દિવસોમા કે અમુક મહિનાઓમાજ નાત અથવા સગાઓને મળ્યા પછી તરતજ એ મહાપાતકમાથી મુક્ત થવાનો ધર્મપૂર્વક તમે નિશ્ચય કર્યો હતો અને પરિષદના પીરાણા સતપંથને જડમૂળથી ઉખેડી નાખવાનો ઠરાવ, તમે એ ઠરાવપત્રક ઉપર સહી કરીને સ્વીકાર્યો હતો, એ વાતને આજે લગભગ પંદર પંદર મહિના વીતી ગયા છે, છતા આળસ અને બેદરકારીથી, અથવા શરમ કે દબાણથી, તમો એ પવિત્ર વચન, ફરજ અને પ્રતિજ્ઞાઓને હજી સુધી પાળી શક્યા નથી ! ત્યારે વિરોધીઓ તો પોતાની કપટવી કરવત અંદર ને અંદર ચલાવતા રહી, મક્કમ પગલે આપણી સુધારક હિલચાલના મૂળો કાપવાને મહાભારત મા થાક્કોક કરી રહ્યા છે અરે, આપણા પવિત્ર વેદ, દેવદેવી અને ધર્મશાસ્ત્રોનો તેઓ ભયંકર દ્રોહ

realpatidar.com

https://archive.org/details/bk662/page/n6/mode/1up

realpatidar.com

કરી રહ્યા છે, અને પૂજ્ય ઋષિ-મુનીઓ, દેવો, બ્રાહ્મણો તેમજ હિંદુ-ધર્મ પાળનારા આપણા સર્વ ભાઇઓને પણ છચોક ગાળો સંભળાવી રહ્યા છે, તે તમે કયા હૃદયથી સાંભળી શકો છો? શાસ્ત્રો તો કહે છે કે, **વેદ અથવા દેવતાઓને ગાળો દેનાર અથવા તેમનું અપમાન કરનાર પાખંડીની તો જીભજ ખેંચી કહાડવી જોઇએ.** એ જાણવા છતા કેમ જાગતા નથી? અરે! આપણને તેમજ સતપંથી સીવાયના બધા હિંદુ અને અન્યધર્મીઓને "વર્ણસંકર" કહી ગાળો દે, તે છતા તમો હજી જાગતા નથી?! અને એવા પાપીઓના ખોટા દબાણથી હતાશ થઇને તમારા પવિત્ર વચનોને કેમ વિસારી બેઠા છો? **વ્હાલા આત્મબંધુઓ! જાગો,-જાગો. એ માંસાહારી, દુરાચારી, પરધર્મ અને પરધનને હરનારા, મુસલમાની સૈયદો તેમજ વટલીને વંઠી ગયેલા સતપંથના કાકાઓ, તથા આપણી જ્ઞાતિના આપ મતલબી, દુરાચારી, તેમજ જુલ્મગાર આગેવાનોની ગોઝારી ગૂલામી-અરે! રૌ રૌ નરકમાં નાખનારી એ મહાપાપની અધર્મી ઝૂસરીમાંથી હવે તો છૂટા થાઓ** જે ગુમાની અને અર્ધમુસલમાની ગદેરાઓ, પોતે ધર્મ ગુમાવી, જેમને અડકીને પણ ન્હાઇ નાખવુ જોઇએ, એવા મ્લેચ્છ સૈયદોના ચરણામૃત પીએ અને પીવરાવે છે, તથા તેમની ગટરમા ફેંકવા જેવી એંઠ અને જૂઠણનો પવિત્ર પ્રસાદ મનાવી, પોતે ખાઇને બીજાને ખવરાવી, હિંદુજાતિનું સત્યાનાશ કાઢી રહ્યા છે અને ફરજીયાત તરીકે મુડદા દાટવાના મસાણ અને કબ્રસ્તાન જેવા અપવિત્ર સ્થાનોમા ઉજાણીઓ જમાડવા જેવા ભૂંડા કામો કરાવે છે, આપણી જાતિના મુડદાઓને જમીનમા દફનાવી, હિંદુના પવિત્ર શરીરોને માટીના કીડાનો ભોગ ધરાવવાનો મહાન્ અધર્મ ચલાવે છે, લગ્ન જેવી પવિત્ર ક્રિયામા પણ ધર્મશાસ્ત્રની વિધિને બદલે બનાવટી મુસલમાની દુવાઓ પઢાવે છે અને ગાય-પીપળાની તેમજ વેદ અને દેવતાઓની પૂજાઓ તજાવી દઇ, દુવા અને કલમા પઢાવી આપણને મામદા હિંદુ-છુપા મુસલમાનો-બનાવે છે, એવા ધર્મનાશના ઇજારદારોની સાથે, હે પવિત્ર ભાઇઓ! તમારા જેવા સદાચારી, સમજુ અને સુધરેના ભાઇઓને કોઇપણ જાતનો સંબંધ કે સહકાર એક પળવાર પણ ન શોભે તે નજ શોભે

વ્હાલા ભાઇઓ! આપણે તો આજસુધી બેદરકારી અને આળસની પાપ પથારીમા આંખો મીંચીને ઉંઘીએ છીએ, ત્યારે પેલી તરફ સામો પક્ષ પોતાની પાખંડજાળ નિભાવી રાખવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે પરંતુ હજારો પ્રયત્નો કરવા છતા પાપ અને અસત્ય ફાવી નજ શકે, એ કુદરતી નિયમ પ્રમાણે તેમની લુચ્ચાઇમા જોઇએ તેઓ ફાવી શકતા નથી, અને કેટલાક સાચા સુધારકો તેમનો પીછો પકડી, તેમના પાપપ્રપંચોને ઉઘાડા પાડી, તેમને હરાવી-હંફાવી-જગતમા ફજેત ફજેત કરી રહ્યા છે તો પણ હરામનો ચસરકો લાગેલો, એટલે હરામખોરી કરવાની પરાપરાથી પડેલી તેમની ટેવ ટળતી નથી, અને ની પૂંછડી સેંકડોવાર મરડીને સીધી કરવા છતા હજી સીધે રસ્તે વળતી નથી!

મુસલમાન સૈયદ બાવાસાહેબ અહમદઅલિ "ખાકી"નાં તરફડીયાં!

એ "પીરાણા સતપંથ"ને નામે હિંદુઓને ધૂતી ખાનારા અને ધર્મભ્રષ્ટ કરનારા પ્રપંચી એ કબ્રસ્તાની અને ખીચડીયા પંથના કેટલાક મુખ્ય ખટપટીઆ ખેલાડીઓમાના ખાસ એક, મુસલમાની સૈયદ બાવામીયા અહેમદઅલિ ખાકી, હાલમા એ સડેલા સતપંથનો બચાવ કરવાને બહાર પડયા છે! એ ખરૂં જ છે કે, હરાયા ઢોરની પેઠે પારકી વાડીઓમા ઘૂસી જઇને જેમને હરામનું જ ખાવાની વંશપરંપરાથી બૂરી આદત પડી ગઇ હોય, તેને સત્ય અને પ્રમાણિક માર્ગ તે શી રીતે સૂઝે કે સાચી સલાહ તે શી રીતે રૂચે!

realpatidar.com

https://archive.org/details/bk662/page/n7/mode/1up

realpatidar.com

ગગવો કુવો અને ગંગાજીનો ગપગોળો !

અમારા વિચારવાન્ વાચકો તો જાણેજ છે કે, થોડાજ મહિના અગાઉ એવા કેટલાક હરામખાઉ અને પરવારતા સતપંથી પ્રપંચી જીવડાઓએ જગત્‌ની આંખમાં ધૂળ નાખવા માટે એક વિચિત્ર નવી બાજી ગોઠવી હતી અને પીરાણામાં ગંગાજી ફૂટી નીકળવાનો બનાવટી ચમત્કાર ઉભો કરી, પોતાના વિખરાઇ જતા સેવકોરૂપી ઘેટાના ટોળાને એ કબ્રસ્તાની વાડામાં પાછા પૂરવાને એક નવો નાટક ઉભો કીધો હતો. પણ એ લુચ્ચાઇ અમારા જાણવામાં આવતા તરતજ અમે જાહેરપત્રો તેમજ છૂટા લેખો દ્વારા તેમનો એ કુટિલ પાપનો ઘડો તડાકાભેર ફોડી નાખ્યો હતો ! એથી પેલા દલદલ ઘોડાની લાદ ઉઠાવનારા અને પીરાણાનો ધર્માંધ ખીચડો ચાટનારા સૈયદ મી ખાકીના કાળજામાં તો ખળભળાટનો એક મહાન્ હિમાલય ખળભળી ઉઠયો !

શિવજીભાઇનો સપાટો !

મી૦ ખાકીએ જ્યારે જાણ્યુ કે, પ્રપંચી ચમત્કારનુ આ ધતીંગ ઉઘાડુ પડતા પોગળ ફુટી જવાથી અમારા ખીચડીયા ખાનાઓને કે કુકર્મના કારખાનાઓને, હવે તો જરૂર તાળાજ દેવાઇ જશે, અને અમારા પેટનો પાપી ખાડો પૂરવાનો રસ્તો પણ હમ્મેશને માટે બંધ થઇ જશે, તો અમારા પીરાણાપંથી સૈયદોના તો જરૂર બારજ વાગી જશે, કેમકે મૂલમજૂરી કરવા જતા પણ કોઇ ચાર આના દેવાનુ નથી, અને હરામના માલ મલીદા ખાધેલા એટલે મહેનતનુ કંઈ કામ થવાનુ નથી માટે સાચો ખોટો કંઇક જવાબ તો ગોઠવી દેવોજ જોઇએ વળી બીજા સૈયદો અને સેવકોએ પણ કંઇક ખુલાસો છપાવવા માટે દબાણ ચલાવ્યુ, એટલે આજે સત્તર વરસે પીરાણાની પાપ–જાલમાંથી મોઢુ બ્હાર કહાડી "**મહાન્ ધૂર્તબાજની પોલ**" એવા નામનુ એક પંદર વીસ લીટીનું પતાકડા જેવુ હેન્ડબીલનુ ચીથરીયુ બ્હાર પાડયુ ! તેને અમે ઘટતી રીતે માન–પાન આપીને તરતજ વધાવી લીધુ, અને ગયા મહીનામાજ તેના એકકે એક શબ્દનો સચોટ જવાબ અને ખુલાસો અમે પ્રસિદ્ધ કર્યો છે, અમારો એ જવાબ છપાઇને બહાર પાડવામા થોડાક દિવસોની ઢીલ થઇ, એથી કરાચીના યુવક–મંડલ તરફથી તેના સેક્રેટરી **સ્નેહી ભાઈ શ્રી શિવજી કાનજીએ** પણ **સૈયદ મી૦ ખાકીના** એ હેંડબીલનો દાંડીડોક જવાબ છપાવીને પ્રકટ કર્યો ! એથી તો ખાકીમીયાના કાનના પડદાજ ઉઘડી ગયા જણાય છે ત્યાર પછીના અમારા ખુલાસાથી તો એ સટરપટરીયા સૈયદ સાહેબનુ કાળજુ જ બંધ થઇ ગયુ હોય, એમ જણાય છે એટલે 'સતપંથ'ની સત્યતા જાહેર કરવાનુ તેમનુ લખાણ અમારે પૈસે છપાવી આપવાનુ જણાવ્યુ, છતા પણ મિયાજીના મોઢાપર લાગેલુ સીલ હજીસુધી ઉઘડયુ નથી–બોલો, મિયા ! બોલો, જમાનો તમારા મ્હોમા આંગળી ઘાલી, પડખામા ગોદા મારી મારીને બોલાવે છે, છતાય તમે કેમ મિયાજીની મીંદડી બનીને, પેલા તમારા ગંધાતા ગગવા કુવાની બખોલના કબુતરો ભેગા પારેવડુ બનીને મુગામંતર બેસી રહ્યા છો ? બીજાને જવાબ આપવાને તો તરત મ્હોઢુ બહાર કહાડો છો, ત્યારે અમને જવાબ કેમ દેતા નથી ? સદરહુ **શિવજી ભાઇએ** લગાવેલા સપાટાના જવાબમા એ **સૈયદ બાવાસાહેબ ખાકીએ** હાલ **એક નવુ ખુલાસાપત્ર** છપાવ્યુ છે, તેમા અમારા નામનો પણ ઉલ્લેખ કરીને, આડકતરા આક્ષેપો કરવાના તરફડીયા માર્યા છે, એથીજ આ લેખમા ખાસ અમારે વિસ્તારથી તેનો જવાબ લેવો પડે છે– ખાકીએ પોતાના ખુલાસા પત્રનુ નામ રાખ્યુ છે–"**વેદના વિરોધી પ્રતે પ્રેમોદ્‌ગાર**" એટલે એ નામ ઉપરથીજ સહજ સૂચિત થાય છે કે, તે પોતાના ખીચડીયા પંથને વેદમાર્ગ જણાવવાની સોઇ તથી ફુલડાઈ કરે છે ! અને પીરાણાની પોલો ઉઘાડનારાઓ માટે વેદના વિરોધીઓનુ વિશેષણ વાપરે છે !

https://archive.org/details/bk662/page/n8/mode/1up

realpatidar.com

કેટલી બધી તુમાખી? કેવો ધર્મ-ઢોંગ? કેવી બદમાશી? ઓ સૈયદમીંયા! બસ કરો-હવે બસ કરો વેદનુ પવિત્ર નામ લેવાનો પણ માસાહારી વિધર્મીઓને હકક નથી-તમારા પાખડી પથ સાથે અને તમારા જેવા પરન્યાત-જાતને ભોળવી ભીખી ખાનારા ફકિરોસાથે પવિત્ર વેદ કે વેદ ધર્મને કશુ લાગતુ વળગતુ કે સ્નાન-સુતકજ નથી!

હાસમી વંશ કે હરિવંશ?

સૈયદ બ્હાદૂર! તમે અને તમારા પૂર્વજો, બાપદાદે ઇસ્લામી થઇને પારકે ખોળે બેસી જાઇ, પોતાને હરિવશના કહેવરાવતા અને હરિની ઓલાદમાં પોતાનુ નામ ગણાવી, પોતાનીજ માતાને પોતાને હાથે ગાળ લગાડતાં પણ તમે શું શરમાતા નથી? કોઈ શુદ્ધ મુસલમાન બચ્ચો તો મરતા પણ પોતાને હિદુના વશમા પેદા થયેલા તરીકે નહીજ ઓળખાવે! અરેરે! પાપી પેટ ભરવા માટે તો આ જગતમા તમારા સતપથપ્રવર્તકો સીવાય બીજા કોઇ પણ-છેક છેલ્લે પાટલે બેઠેલા હશે, તે પણ-પોતાના બાપ-દાદા બદલાવીને પરધર્મી પરકોમના પુત્ર થઇ બેસવાનુ સાહસ નહો જ કરે! કહેતો ખરા, હરિના વશમા કયા પુરૂષનુ પુત્રપદ તમારા પૂર્વજોએ શોભાવ્યુ હતુ, કે તમે પોતાને હરિવશના કહેવરાવો છો? કોઇ ઇતિહાસ કે દત કથાનુ કઇ પણ પ્રમાણ બતાવશો કે? વળી મી ખાકી! તમારા બાપદાદાઓએ હરિવશની અટક કયા દહાડાથી ધારણ કરી? હરિવશ સાથે તમારો કેવો સબધ? તમારા પૂર્વજોમા, હરિવશનો પહેલો છોકરો કોણ થયો? તેનો કોઈ જાહેર ઇતિહાસ બતાવી શકશો? અરેરે! આવી રીતે પરધર્મ અને પરકોમનુ નામ પચાવી, પરાણે પારકા છોકરા બની જવાથી કઇ પેટ નહીંજ ભરાય! મી ખાકી! કંઇક શરમ રાખો શરમ રાખો માતા-પિતાની તો કઇક આબરૂ જાળવો! હાથે કરીને હરિવશના કહેવરાવવાથી તમને કેવી ભૂડી ગાળ બેસે છે, તેનો કઇ ખ્યાલ કર્યો છે? વારૂ, તેનો તમે નિરાતે વિચારીને ખુલાસો લખજો. હવે તમારા "પ્રેમોદ્‌ગારની" શરૂવાત કરતાજ તમે લખો છો કે,-"વીરા! અની અદેખાઇ ના કરો સતપથનો નાશ નહી કરી શકો. સૂર્ય ઉપર ધૂળ નાખી મોઢુ ભ્રષ્ટ કર્યું છે!" ઓ મીયાજી! આ પ્રેમવચનોની શરૂવાત કે? તમારા કુલના પ્રેમોદ્‌ગાર આવા પ્રકારનાજ થતા હશે! મી ખાકી! ઘેર ઘેર ભીખ માગી, પાપ પ્રપચથી પેટ ભરનારની તે અદેખાઇ કોણ કરે? અને શા માટે કરે? તમને એવી તે કઇ બાદશાહી કે નામના મળી ગઇ છે, કે બીજા તમારી અદેખાઇ કરે? ફકીર બ્હાદૂર! જરા જાત સભાળો પછી બીજાને ઘટતા અણઘટતા વચનો ઓચરો

શિવજીભાઇને બદલે પોતાનાજ પૂર્વજોને ભાંડયા!

ઉપરનુ મગલાચરણ કરીને ત્યાર પછી એ ઉસ્તાદ સાઇમૌલા પોતાનુ ડહાપણ આગળ ચલાવતા લખે છે કે-"કચ્છી કડવા પાટીદાર યુવકમંડળના સેક્રેટરી શીવજી કાનજીની કુટિલતાની સર્ચલાઇટ નામના હેન્ડબીલ વિષે"-"પીરાણા પથ' એ નામ યોજનારાઓના પડળો જ્યા સુધી ઉતર્યા ના હોય, ત્યા સુધી એવાઓ સત્ય જોવા ભાગ્યશાળી કેમ નીવડે?" 'મીયાજી'! વાત તો સાવ સાચીછે, આ વખતે તો કુદરત તમારે મોઢે સાચુ જ કહેવડાવે છે-પીરાણા 'સતપથ' એ નામ યોજનાર ઇમામશાહ અને તમારા પુર્વજો-તેમની આખે પ્રપચના પડળો ચ્હડેલા, તે તમારા જેવા કોઇ સપુતે આજ સુધી ઉતાર્યા નથી, એટલે એઓ બિચારા 'સત્ય' જોવાને ભાગ્યશાળી કેમ નીવડી શકે?

બનાવટી ગંગાજીનો બનાવટી બચાવ!

ત્યારપછી મી. ખાકી લખે છે કે,-"ગગાજીના નામથી આકળ-વિકળ બની જનારાઓએ શઠતામા શુ ગળાઇ, સ્વપાત્રતાનો પડદો પાડી સ્વપોત પ્રકાશી દીધુ છે" આ વાકય પણ તમારી પાસે કુદરતે છેક

realpatidar.com

https://archive.org/details/bk662/page/n9/mode/1up

realpatidar.com

સાચુંજ લખાવ્યુ છે—પવિત્ર વેદધર્મી હિંદુઓ તો આજે અનેક યુગો થયા ગંગાજીના નામથી, અને સ્નાનથી સદાય પરમ શાંતિજ ભોગવે છે પણ ગંગાજીના નામથી આકળવિકળ બનેલાઓએજ તમારા પાખંડ ધર્મનો પ્રચાર કરી, મુડદાના હાડકાવાળી કબ્રસ્તાની અપવિત્ર ભૂમિના એક ગંધાતા ગટરીયા કુવાને ગંગવા કુવાનું નામ આપ્યુ છે અને પોતાની શઠતામા ગુંગળાઇ તેમણેજ પોતાની જાતમાતનુ પોત પરખાવ્યુ છે બાકી કથીરમા કનક, થોરના છીરમા દુધ, કાક વિષ્ટામા પ્રસાદ અને લીંબડાના પાનમા કદાચ સાકરની મીઠાશ હોય, તો પણ પીરાણાની કબ્રસ્તાની ભૂમિમા કે ગંગવા–કુવામા તો ગંગાજીનો એક લેશ પણ ન હોઇ શકે!

મી૰ ખાકી કહે છે કે,—"બુદ્ધાવતારનો સમય પૂર્ણ થનાજ શ્રી ગંગાજી પીરાણે પધારેલા છે દાભડાવાળા પ્રદેશમા ગંગાજી પધારશે, તેવુ વેદિકશાસ્ત્રો કહે છે, તેને સાચુ માનવુ, તે વેદ માનનારાઓ માટે છે"

મી ખાકી! આ વાત કયા ઇતિહાસમા કે વેદિક શાસ્ત્રોમા વાચી આવ્યા છો? તમે તમારી હમેશની ટેવ મુજબ કોઈ નવો ગંધર્વ વેદ તો નથી લખ્યો? જેમ તમારા બનાવટી અને તરકટી ખોટા બુદ્ધાવતારમા તમે ધોળે દહાડે રાત બતાવી, પાડવોને ગોહત્યા કરનારા જણાવી, જે અનેક નીચ વાતો ઠોકી ઘાલીને, હિંદુ ધર્મનુ હડહડતુ અપમાન કર્યુ છે, તેવો એ કોઈ નવો વેદ તો નથી ઘડયો? એ બુદ્ધાવતારમા તમારા ગંગવા કુવાની ગટરને ગંગા તો શુ, પણ ક્ષીરસાગરનો વડ દાદો કહો, તો પણ તમને કોણ રોકી શકે તેમ છે? એમ તો કુંભાર પણ કહે છે કે, મારો ગધેડો રાજાના હાથી કરતાંયે વધારે પરાક્રમી છે! પણ એથી જગત્ કંઇ એ માની લેશે? હિંદુના કોઈ પણ પવિત્ર ધર્મ ગ્રન્થમા તમારા કબ્રસ્તાની પીરાણાનુ નામ પણ લખાયેનુ નથી પરંતુ એ તો બધી તમારી અને તમારા મતલબી પૂર્વજોનીજ પ્રપંચી બનાવટ છે

આખાં કાશી સાથે ગંગાજી પીરાણે આવ્યાં! માર તોપ!!

ઉપરના ફકરાની નીચેજ ગંગાજી પ્રકટ થવા બાબત મી ખાકી લખે છે કે,—

'શ્રી મદ્ગોર પીર ઇમામશાહ બાવાના સમયે **પીરાણામા ગંગાજી કાશી જેવાં પવિત્ર ક્ષેત્ર સહિત પધારી, હજારો માણસોને પવિત્ર કરી, પ્રખ્યાતિ પામેલ છે** આજ કાંઇ નવાઇની વાત નથી" સંવત્ ૧૯૮૦ ના ભાદરવા માસમા મહિજડા ગામે શ્રી ગંગાજીએ એક વિચિત્ર સ્થળે પ્રગટ થઈ સાક્ષાત એક બાળકન્યા રૂપે ત્યાના સાંમવિક યાત્રાળુઓને દર્શન આપી, સૂચના કરી હતી કે,—"(૬) છઠ્ઠા માસે હુ પીરાણે પ્રગટ થઇશ" એ કથા દર્શને આવનારા મહિજડાના યાત્રીઓ કહેતા હતા–હજુ કહે છે ને કહેશે ખાત્રી કરવી હોય, તો ત્યા પધારી ખાત્રી કરી જૂઓ"

શાબાસ! સૈયદ ખાકી! આતો ઘણી આબાદ તોપ ફેંકી! પણ ટાઢાજ પ્હોરની હો! ઇમામશાહની સાથે કાશી જેવા પવિત્ર ક્ષેત્ર સહિત ગંગાજી પીરાણે પધાર્યા, ત્યારે તે એવડુ મ્હોટુ કાશીક્ષેત્ર અને એવડા અનંત જલભર્યાં ગંગાજી પીરાણાની કંઇ કમરમા છૂપાઈ બેઠા? ગંગાજી આવ્યા, તો પીરાણુ તેમા ડુબી કેમ ન ગયું? શુ ઇમામશાહ બાજીગર હતા, કે તેણે ગંગાજીને અને કાશી જેવા વિશાળ ક્ષેત્રને પણ કોઇ બીજુજ ન્હાનું રૂપ આપી દીંધુ? કાશીજીનો પોપટ બનાવ્યો કે ખબુતર? અરે ખાકીજી! તમે તો ખાકીને તમારી બધી વાતોય ખાકી! એટલે તમે તોપ હાકવામા કંઈ ના રાખ્યુ બાકી! ફકિર ભોલા! આવી લાલ બુજરગ જેવી વાતો કોઇ જંગલના ભીલોને સંભળાવી હોત, તો આજે તે પણ ખોટી કહીને હસી કહાડત–ત્યારે આ વિજ્ઞાન અને સભ્યતાના પ્રકાશિત જમાનામા એવી અરેબીયન નાઇટ્સ જેવી તોપોને તે કોણ માનવાનુ છે!

VSAK: Between 31-Aug-1924 and 28-Sep-1924

realpatidar.com

https://archive.org/details/bk662/page/n10/mode/1up

realpatidar.com

ત્યારે બોલ્યા બાવા ઇમામશાહ !

વળી તમારા ધૂર્તશિરોમણી ઇમામશાહ તો લખે છે કે, ભારતના અડસઠે તીર્થો પીરાણાના ગંગવા કુવામાં આવીને રહ્યા છે ! એથી તમારી એકવીસે પેઢી તરી ગઇ અને બેહેસ્તની બાદશાહી પણ તમનેજ મળી ગઇ ! ત્યારે પછી બિચારા ગરીબ, નિર્ધન, મજુરી કરી પેટ ભરનારા, કણબી, કોળી, કાછીયા, ગોલા જેવા અજાણ સેવકોને લૂટીને અંધશ્રદ્ધાળુ જનોની પાસેથી લડી વઢી શા માટે પૈસા નીચોવી કાઢો છો ? બેહેસ્તનો ખજાનો મળ્યો છે, છતાય ભીખ ન છૂટી ? વળી મી ખાકી ! જો ઇમામશાહ બાવા પોતાની હૈયાતીમાજ **કાશી અને ગંગાજીને પીરાણે લાવ્યા**, તો પછી ત્યાંથી નાશી જઇને મહિજડા ગામમા એક વિચિત્ર સ્થળે સાક્ષાત્ એક બાળકન્યારૂપે તે કેવી રીતે પ્રગટ થયા ? અને તે વળી કોઇ વિચિત્ર સ્થળે ! **વિચિત્ર સ્થળ તો સંડાસ કે મુતરડીજ હોય !** તો મહિજડાના કયાં વિચિત્ર સ્થળે તે પ્રકટ થયા, એ જણાવશો કે ?–અને એ કન્યારૂપ ગંગાજીએ કહ્યુ કે, "હુ છઠ્ઠે માસે પીરાણે પ્રગટ થઇશ !" ત્યારે એ છ મહીના સુધી તેઓ કયા ભટકતા હતા ? અરે મી. ખાકી ! આ જ્ઞાન-ભૂષિત જમાનામા આવી નમાલી–બનાવટી–કુદરતવિરુધ્ધ વાહિયાત વાતોથી તમે કોને બનાવવા માગો છો ! ? હવે તો તમારા મેંઢા જેવા સેવકો પણ સમજીને ચેતી ગયા છે, એટલે એવા કોઇ ભાડુતી યાત્રાળુઓને ભણાવી ગખીને બનાવટી ચમત્કારોની બાંગ પોકારશો, એટલા તમેજ જગતમા વધારે બની જશો, એ નક્કી જાણજો–વધારામા ભોઠા પડશો અને ભૂંડા ગણાશો, માટે હવે તો એવા પાખંડો અને ધતીંગો તમે જવાજ દેજો વળી ખાકીજી ! જો ગંગાજી છ મહીને પીરાણે પ્રકટ થવાના હતા, તો એટલો વખત તમારો ગંગવો કુવો અને પાપધામ પીરાણુ તો ગંગાજી વગરનાજ બની રહ્યા હશે ! એ તમારા પોતાના શબ્દોથીજ સિધ્ધ થાય છે, ખરૂ ને ?

મી ખાકી ! ખરૂ પૂછો તો જ્યાં માંસાહારી મ્લેચ્છોજ મુખ્ય ભાગે વસતા હોય, જ્યાં કબ્રસ્તાનમા દાટેલા મુડદાઓથી જમીન અપવિત્ર બની રહી હોય જ્યાં પવિત્ર આર્યોને ઠગીને વટલાવવામા આવતા હોય, એવા પ્રપંચી પાપધામમા ગંગાજીના પ્રકટ થવાની વાતો તો સસલાને સીંગડા ઉગાડવા જેવી અને વાઝણીના છોકરા રમાડવા જેવીજ બનાવટી જાણવી !

હિંદુજાતિ ઉપર ભયંકર આરોપ !

સૈયદ બાવાસાહેબ ખાકીનુ ખાકી પૂતળુ આગળ જતા જણાવે છે કે, 'ગંગાજી પોતાને સ્થળેથી જીવહત્યાના મહાદોષોએ કંટાળી ગુજરાતમા આવ્યા છે–ગંગાતટ વાસીઓની ઘણી કોમો, તેમજ તમારા ગુરૂજનો બ્રાહ્મણાદિ સર્વ માંસ માછલાના ભોગી બનેલા જોઇ શ્રી ગંગાજી પીરાણે આવતા રહ્યા ગુરૂ માંસાહારી–તેના યજમાનો કાંઇ તેથી ઓછા ન હોય !"

મી. ખાકી ! જેવુ અન્ન તેવોજ ઓડકાર–તમે જેવા છો તેવાજ બીજાને કહો છો, અને નીચ યુકિતઓથી હિંદુઓના પવિત્ર ક્ષેત્રોને બદનામ કરી તમારા કબ્રસ્તાનનો ખોટોજ મહિમા વધારી રહ્યા છો ગંગાતટવાસી પવિત્ર આર્યજાતિને તેમજ બ્રાહ્મણો, ગુરૂઓ અને યજમાનોને, બધાને માંસાહારી કહી, તમે અખિલ હિંદુજાતિની ભયંકર બદનક્ષી કરો છો જો ન્યાયાસન સમક્ષ તમારી આ નીચ હરામખોરીનો જવાબ લેવાને કોઇ પણ ધર્માભિમાની હિંદુ તૈયાર થશે, તો જરૂર તમને ભારી પડશે,–તમારી બડાઇની ડાકલી તમે ભલે ગમે તેમ વગાડો, પણ પારકા ધર્મની નિંદા કરવા જતા સંભાળજો–વખતે તમને ભોય પણ ભારી થઇ ન પડે ! વળી મી ખાકી પોતાના હેડબીલને છઠ્ઠે પાને નવી તોપ ગોઠવે છે કે–" પીરાણે ગંગાજી પ્રગટ થાશે, તેવી ભવિષ્યવાણી ભવિષ્યપુરાણાદિ પુસ્તકોમા છે, જુઓ. પછી પૂછવા આવો. શ્રી સદ્દગોર ઇમામશાહ તો ઘણી વાર લખી

https://archive.org/details/bk662/page/n11/mode/1up

realpatidar.com

ગયા છે કે, ગંગાજી પીરાણામાં આવશે" મી. ખાકી! આવું હડહડતું જૂઠું તમે ક્યા ભવને માટે લખો છો? કોઇ પણ વ્યાસકૃત પુરાણમાં જો તમે પીરાણાનું નામ પણ બતાવો, તો તમને અમારૂં આગળ જણાવેલું ઇનામ આપવાને અમો તૈયાર છીએ, નહીં તો, તમે પીરાણાના પાખંડો છોડી, તમારા મૂળ ઇસલામી ધર્મને પકડીને જરા નીતિ અને નેકીનો માર્ગ ગ્રહણ કરતા શીખો.

વંઠેલાઓની વેદ–સેવા!

તમારી ભીખના ખુલાસાઓમાં એ છઠ્ઠે પાનેજ તમે લખો છો કે, "**વેદની સેવા માટે પૈસા માગવા અતિ ઉત્તમ છે.**" ખાકી! તમે વેદની કેવી સેવા કરો છો, એ શું જગત નથી જાણતું? વેદધર્મિઓને વટલાવી, મુમના બનાવી, કલમા પઢાવવા અને નુરની ભ્રષ્ટ ગોળીઓ ચડાટવી, એજ તમારી વેદની સેવા કે? વાહરે! કલિયુગી વેદસેવક! તમારી આ વેદ–સેવાનો અલ્લાહ તાલા કેવો જવાબ લેશે, એનો તમે કંઈ ખ્યાલ કર્યો છે? તમારા ઇમામશાહે તો એક ગંગાજીજ નહી, પણ અડસઠ તીર્થ પીરાણે આવ્યાનું–અનેક વાર જણાવ્યું છે, અને એ પ્રપંચી જૂઠાણું આખું જગત્ જાણી પણ ચુક્યું છે ઇમામશાહે હાઈ તરીકે કરેલી નિઝારીઓની દલાલીથી હવે કોણ અજાણ્યું છે?

શ્રી રામચંદ્ર અને કૃષ્ણચંદ્રની નિંદા!

મી ખાકી, વળી આગળ લખે છે કે—

"શ્રી રામચંદ્રની શત્રુવટમાં બ્રાહ્મણ કોમ ઉભરાઈ નીકળી–આખી જગત્‌ને વેદથી વિમુખ કરી દીધી ત્યાં સુધી કે શ્રી રામચંદ્રજીના જીવના શત્રુ અઢાર ક્ષોણી બ્રાહ્મણો થઇ પડયા"–શ્રી કૃષ્ણનો નાશ કરવા ઘણી યુક્તિયો સમાજ કરતો હતો શ્રીજીને ચોર, પીંઢારો, છીનાળવો, વર્ણ-સંકરાદિ પદ્દિઓથી પ્રસિદ્ધ કરતા હતા" સૈયદ ખાકી! આવા હડહડતા જૂઠાણાથી અતિ નીચ નાપાક શબ્દો બોલી હિંદુજાતિનો ભયંકર દ્રોહ કરતી વખતે તમારી જીભમાં કાંટા કેમ નથી ઉગતા? આ બધો ખોટો બકવાદ તમે કોની સામે કરો છો? આ વાતો તમે ક્યા ઇતિહાસમાં વાંચી આવ્યા છો, તે સ્પષ્ટ જણાવી તમારી સચ્ચાઇને સિદ્ધ કરી બતાવો નહી તો ખબરદાર! કોઇ કમજાત ગોલાને પણ ન છાજે, એવી રીતે તમે અમારા પરમપૂજ્ય ઇશ્વરાવતારોને આવા શબ્દો લખો છો, તેનું પરિણામ તમારે ઘણુંજ સખ્ત વેઠવું પડશે બીજાનો ધર્મ અને જાતિદ્રોહ કરનારને બ્રિટીશ ન્યાય શી શિક્ષા કરે છે, તે તમે જાણોછો કે? જરા પીનલકોડ ધ્યાનથી વાંચી જજો

ઇમામશાહનું રગસીયું ગાડું!

વળી પોતાના પ્રપંચી પૂર્વજોની બહાદુરી બતાવતા, મી. ખાકી લખે છે કે,–"શ્રી સદ્‌ગોર ઇમામશાહ બાવાનું વેદનું ગાડું અસંખ્ય વરસથી રગસ રગસ ચાલતુંજ આવ્યું છે–" મી ખાકી! તમારા પૂર્વજોનું એ વેદનું નહી, પણ ઠગાઇ અને પાખંડનું ગાડું, અને તે પણ એક દાઇ એટલે દલાલ થઇને પોતાના શેઠ ઇસમાઇલી નિઝારી ઇમામોનું હરામખોરીથી પચાવી પાડેલું, કલજુગના અંધારાને પ્રતાપે જરૂર રગસ રગસ એટલે પડતું આખડતુંજ આજ સુધી તો ચાલ્યું, પણ હવે તો એ પાપનો ઘડો પૂરેપૂરો ભરાઇ ગયો છે રાઇના પાડ રાતે વહી ગયા તમારી ઠગબજારનું મુખ્ય થાણું કચ્છ, જ્યાંથી તમને લાખ લાખ રૂપીયાની દર વરસે દશોંદ મળતી, ત્યાંથી આજે ફકત દશમો હિસ્સોજ માંડમાંડ મળે છે અનેક ગામોએ તો દશોંદ મોકલવી બીલકુલ બંધ કરી દીધી છે, અને હજારો સેવકો તમારી ઘોર કુકર્મી પ્રપંચજાળની પાપ–દોરીઓને તોડી નાખી, દરરોજ તમારાથી છૂટા થતા જાય છે એ બધું તમારા જાણવામાં તો છે, પણ શું કરો? પાપી પેટની વેઠ ખાતર ખોટા બણગા પણ તમારે ફૂંકવાજ પડે! સૈયદ ખાકી વળી ત્રીજે પાને લખે છે કે,–'દુધ અમૃત છે

https://archive.org/details/bk662/page/n12/mode/1up

realpatidar.com

પણ રોગીને ઝેર થાય, તેમાં દુધને કેવો દોષ ? "મી૦ ખાકી ! એ ખરી વાત છે અમારી દુધ જેવી–અમૃત જેવી–સલાહ તમને હજી પણ ઝેર જેવીજ લાગે છે અને તમે તમારા પાખંડ છોડતાજ નથી, એમા અમારી શિખામણને તેમજ તમારો પણ કંઇ દોષ નથી. પણ ઠગાઇથી હરામનુ ચાટવાનો જે તમને લાબા વખતથી ભયંકર રોગ લાગુ પડયો છે, તેનોજ એ બધો દોષ છે ! મી૦ ખાકી પોકારે કે કોણ કહે છે રાંપીનો ઘા ? તેનો એજ ખુલાસો હોઈ શકે, કે ભવિષ્યના આરીસામા તમારા પોતાના કર્મોનો ચ્હેરો જૂઓ–હાથ કંકણને આરસીની શી જરૂર છે ? તમે બેહેસ્તના ઇજારદાર પોતે ભીખ માગતાજ રહ્યા છો અને તમે પોતે લખો છો અને કબુલ કરો છો, તેમ "**હંધુત કેવા થયા છો, તે આખા દેશમાં પ્રગટ થઇ ગયુ છે**"

અમારા ઉપર આક્ષેપનો ઘા !

એ હેંડબીલને ત્રીજે પાને છેલ્લા ફકરામા મી૦ ખાકી સૂર્ય સામે ખાક ઉરાડવાનો યત્ન કરી, જાતેજ આંધળા બનવા માટે છાતી ફુલાવીને લખે છે કે—

"તમારા જ્ઞાતિસુધારક (દગાડક) મી૦ નારાણજી રામજીભાઈ પોતાના લેખમા યુક્તિએ હમારી શાન્તિનો ભંગ કરવા ને કાકા સૈયદો સાથે વઢાડવા પ્રપંચ કર્યો હતો–તે પૂરતોજ મારે જવાબ દેવો પડયો તે સત્યતાએ આપ્યો–તેમા કઈ વાત હમારી ખોટી છે ? તે લખવુ હતુ કા પ્રાસંગિક ચર્ચા સહવિવેકે કરવી હતી આમ અવળુ બોલી ગાળો ભાંડવામા બહાદુરી નહી ગણાય–તમે મારા લેખનો જવાબ આપ્યોએ નહીં ગણાય–મારા લેખનુ ખંડન પ્રમાણસહ કરી ખોટુ કરી દેખાડવુ હતુ–આમ ગાળો ન ભંડાય–હમારા લેખમા બિભસ્તતાને નિંદા કયા છે, આતો તમો તમારૂ સ્વરૂપ જોઇ ભડકી પોકાર પાડો છો"

ખાકીની બેધારી બાજી !

મી–ખાકી ! તમને કાકા અને સૈયદો સાથે વઢાડવાનો મે પ્રપંચ કર્યો, કે તમારી નીચતા એ ? તમે સામૈયુ અને વરઘોડો કાઢીને ખેરીયાતની દોલતનુ નખોદ વાળવા માટે કોર્ટે ચઢયા હતા, તે મેં ચડાવ્યા કે તમારી અને સૈયદોની નીચ આપમતલબે ? તમારી કઇ વાત સાચી છે ? તમે બાલેમાલ જૂઠાઇથીજ ભરેલા છો–લખવુ, બોલવુ–ચાલવુ–બધુ જૂઠુ અને બધુ જગતને ધૂતી ખાવા માટેનુ જ છે વળી તમે લખો છો કે, "મારા લેખનો જવાબ આપ્યોએ નહી" પણ તમારો લેખજ કયા હતો ? લેખ માટે તો તમે પૈસાની તેમા ભીખ માગી હતી અને વધારામા **પોતાનુ થુકેલુ ચાટીને, પોતેજ લખેલા જે લેખને અમે ટાંકી બતાવી, તમને માન આપ્યુ, તેનો પણ ઇન્કાર કરી, કુટિલ કાકા અને પાખંડી સૈયદોને પુણ્યશાળી કહી, તેમને પગે પડયા–રડી–કકડીને માફી માગી–પોતે લખેલું પોતેજ રદ કરીને નાલાયકી અને નામર્દાઇ બતાવી !** એજ તમારા લેખનો મહિમા અને એજ તમારી પોપલીલા કે ? જે કાકાને ભરકોર્ટમા ન્યાયાસનની સ્હામે, ખુદાને નામે, સાચુ બોલવાની ગંભીર પ્રતિજ્ઞા લઇને, ઘણા અપકૃત્યો કરનારા, સ્વાર્થી, પૈસાનો ગેરઉપયોગ કરનારા, વ્યભિચારી–અપ્રમાણિક–પારકી મિલ્કત ખાઇ જનારા અને બદચાલના કહ્યા હતા, તેમનેજ પાછા તમે "પુણ્યશાળી" કહેવાને બહાર પડયા છો ? ત્યારે એમા સાચુ શુ ? અને ખોટુ શુ ? કોર્ટમા સોગનપર આપેલી જૂબાનીઓ ખોટી, કે હાલમા માલપાણી ચાટવાને માટે તમે કરેલી ખુશામત ખોટી એ બન્ને ઉલટી–સુલટી વાતોમા કઇ ખરી ? એ કયે મોઢે બોલ્યા હતા ?

મી૦ ખાકી ! તમારા વર્તનનો વિચાર કરતાં તો કલમ પણ કંપીને કમકમી ઉઠે છે—
મી. ખાકી ! તમે તો ખરેખરા ખાકીજ, એટલે બધુ છેક ખાક જેવુ જ કરશો ! વળી મી. ખાકી

realpatidar.com

https://archive.org/details/bk662/page/n13/mode/1up

realpatidar.com

પોતાના હેડબીલમા બડાઇ ગાઇને મોટે ઉપાડે લખે છે કે હમારા લેખમાં બિભસ્તતા ને નિંદા કયાં છે ! એજ ખાકી, એજ લીટીની નીચેના પેરામા લખે છે કે–" તમો પારસીયા કહેવાવ છો, તો તે અટક કયાંથી પડી ? પારસી જ્ઞાતિને અને તમારે કેવો સબંધ ? બાકી જાત ઉપર બાત ત્યારે દેખાઇ રહેશે " આ તો જરાપણ બિભત્સ નિંદા નહીં, પણ મીયા ખાકીના મત પ્રમાણે તો એ ફુલના હાર તોરા કહેવાતા હશે ? ! "

ખાકીના પિત્રાઇ ભાઈ જુમ્માની બ્હાદુરી !

વળી તેની નીચેના પેરામાં ખાકી લખે છે કે–" નોતીયાર જુમ્મા ગુરૂને પોખણાના દિવસોમા ઘરે જવાન છોકરીની સાથે રાખી, મા–બાપો છ–૭ સાત સાત રાત્રિ દિવસ જંગલમાજ રહે, રખડેલ પાખંડી લુચ્ચો માણુસ પાખંડ કરીને પોષાય ! " આ પણુ બિભત્સ નિંદા નહીં હોય ! પણુ ખાકીના સતપંથનાં જ્ઞાન ! વળી બીજા પાનામા મી ખાકી લખે છે કે, " હમારી ગંગા સાચી, માત્ર તેના વિરોધી વર્ણુસંકરોજ જૂઠા. " આ સુંદર વાણી તો બિભત્સ નિંદા નહીં, પણુ ખાકીની પવિત્ર વેદવાણી હશે ! ધન્ય છે ! બનાવટી હરિવંશમાં અવતરેલા વર્ણુસંકર, ઠગારાઓના વંશધરને ! ખરી રીતે તો પીરાણા સતપંથ વર્ણુસંકર, તેણુે ગોઠવેલી ચારે યુગની વંશાવળી વર્ણુસંકર, તેમનું સાહિત્ય વર્ણુસંકર, હરિવંશના ગોઠવેલાં ખટપટી ખોટાં પાઠીયાં વર્ણુસંકર અને તેના સ્થાપકે રજુ કરેલી પોતાના પરિવારની આલઔલાદ પણુ તેને પોતાને હિસાબે અને જોખમે વર્ણુસંકરજ ! અને વળી પાપી પીરાણા સાથે પવિત્ર ગંગાજીનું નામ જોડવું એ પણુ બદમાશોની વર્ણુસંકરતા સીવાય બીજુ શું હોઇ શકે ? મચ્છ–કચ્છ–વારાહ–બુદ્ધવગેરેના કુળમાં પેદા થયેલા પીર અને સૈયદો ! એમનો કયો વર્ણુ હોય ? એ તે સંકર કે કંકર ? મી ખાકી ! કંઇ છે આનો ખુલાસો કરવાનું તમારામા પાણી ? હોય તો, આવો મેદાનમા–જાત જણાવો ! પોતે જાતે ધર્મે અને ધંધે, જો વર્ણુસંકર હોય, તેમ છતા પોતાના પાખંડધર્મનો વિરોધ કરનારી સમગ્ર પવિત્ર પ્રજાને વર્ણુસંકર કહેવાની ધૃષ્ટતા કરે, તે આગળ તો અધમતાની અવધિજ સમજવી ! કહો, હવે તમારી બિભત્સ નિંદાની વધારે લીલા શું બતાવું ? જ્ઞાતિસેવક અને સુધારકને "દઝાડક" કહેવા નીકળેલા, હાબડા દેશવાસી દગાબાજ અગારિઆને તે બીજી કંઈ ઉપમા આપવી, એજ કંઇ નથી સૂઝતુ ! મી ખાકી ! તમે તો શું પણુ તમારા બડાદાદા ઇમામશાહથી આરંભીને આજસુધીના તમારા બધા સતપંથપ્રવર્તકોએ દુનિયાના બધા ધર્મોની બિભત્સ રીતે ઘોર નિંદા કરવામાજ જીદગી ગુમાવી છે–અને એ બધા સોનેરી ફાગ–ફગાણુાની હોળી, તમારા છુપા ધર્મશાસ્ત્રો અને ગીનાનોમા ઠામઠામ ભરેલી છે, જે જાહેર આલમને જણાવવામા આવતાજ, આખી દુનિયા તમારી દુશ્મન થઇ બેસે એવા તેમના કુકર્મો છે –અને થોડી સબુર કરો, હવે તો થોડાજ વખતમા એ બધી તમારી પાપલીલા અમે "પીરાણા સતપંથની પોલ " નામના મહાન ઇતીહાસિક ગ્રંથમા ઢોલ–નગારા વગાડીને જગજાહેર ઉઘાડી પાડીએ છીએ, પછી જગત્ તમારો કેવો સત્કાર કરે છે, તે ઠંડો જીવ રાખીને આરામથી અનુભવી લેજો, અને ત્યારેજ "તમે કહો છો કે,–"સતપંથમાં સપુતોજ હોય છે, ત્યાં વર્ણુસંકરતા નાં હોય, એ તો આપનું આપને સદા અખ્યાતુ રહે !" એ હડહડતી ગાળનો ઘટસ્ફોટ થશે અને ખરા વર્ણુસંકરો કોણુ છે, તે જગતને ચોખેચોખુ દેખાઈ જશે. માટે અહીં તમારી ઢગલાબંધ બિભત્સ નિંદાનું હું વધારે પીષ્ટપેષણુ કરવા ચાહતો નથી.

realpatidar.com

https://archive.org/details/bk662/page/n14/mode/1up

realpatidar.com

સૈયદો અને કાકાઓને શિરપાવ !

મા. ખાકી ! તમે આ હેંડબીલમા સતપથી કાકાઓ તથા તમારા સૈયદ ભાઇઓની પણ ખુબ સારી ઇજ્જત વધારી છે ! તમે લખો છો કે,–"નથુકાકા અને પુંજામીયા વિષયનો જે તમારો લેખ છે, તેજ ભ્રમ તમને ભૂલાવે છે ધર્મની શોધ પોતાની બુદ્ધિને સદ્‌ગુણો ઉપર છે ધર્મના ભોમિયા ધર્મનુ શુદ્ધ સ્વરૂપ સમજીને સમજાવી શકે છે તેમા બીજાઓના આરોપો મારા માટે રાખી મુકવા, એ તમારી મૂર્ખાઇ છે !" વાહરે, મહાજ્ઞાની ખાકી ! તમે તો જાણે બીજો ઇમામશાહનો અવતાર ! હો, એવો ડોળ ઘાલીને પોતાને મહાન્ બુદ્ધિમાન્ અને સદ્‌ગુણી બતાવી, નથુકાકા, પૂંજામિયા વગેરેને ધર્મનુ શુદ્ધ સ્વરૂપ ન સમજનારા છેકજ મૂર્ખા અને નમાલા બતાવો છો કેમ ? એ લોકો કહે છે કે, "સૈયદ બાવામિયા બડોં ઢોગી છે અને કલ્પિત ઓગણીસમુ પુરાણ બનાવી, મુસલમાન થઇ હિંદુધર્મીનો ડોળઘાલી દુનિયાને ઠગે છે–તે કઇ ખોટુ નથી સૈયદોમા હડહડતા જુઠાણાંના ઇજારદાર નબર વન તો તમેજ છો, અને ઠગપોથીઓ તમેજ રચો છો -બીજા સૈયદો તો બિચારા જાહેર રીતે જણાવે છે અને કબુલ કરે છે કે, અમારો **સતપંથ દીને મહુમ્મદી એટલે ઇસલામી ધર્મજ છે** આટલું પણ સાચુ બોલી, ખેરિયાતના ખીચડા ઉપર તે લોકો તો સતોષ ગુજારે છે–પણ તમારી પાખંડલીલા તો આકાશમાનની સફરે મોકલી દેવા જેવીજ છે, છતા તમે એ બિચારા અજ્ઞાન અને ભોળા કાકા તેમજ સૈયદોને વગોવીને, ધર્મનુ શુદ્ધસ્વરૂપ ન સમજનારા, અભણ મૂડપથ જણાવી, છેક ઉતારી પાડીને, પોતાની બડાઇનુ એ બેસાસુરી ભુગળુ વગાડી શા માટે ભાડભાઇની પેઠે ભવાઇ ભજવો છો ?

વર્ણસંકરની વંઠેલી વાણી !

મી૦ ખાકી ! ઇમામશાહે તો છેવટ અહી સતપથીઓજ રહેશે, એવુ લખ્યુ છે, તે તો તમે કબુલ રાખો છો, અને પાછા પડતા પડતા પણ ટગડી ઉચી કરીને, નફટાઇથી લખો છો કે –"સ્ત્રી જાગિણી બને છે, ત્યારેજ પાટીદાર કે કોઇપણ જ્ઞાતિમા, કોળી–ભીલ, લુવાર, સુથાર, મેઘવાળ, ભવૈયા, ભાડ, કાઠોડિયા ગમે તે વર્ણના પુરૂષથી પ્રજા ઉત્પન્ન કરી દે છે–એ વર્ણસકર પુત્ર સતજ્ઞાની (સતપથનો) ન થાતા જારી પુરૂષના ગુણવાળો થાય છે, એવી વર્ણસકરતા વધી પડેથી ફક્ત અહી ધર્મીજ રહેશે" એટલે તમારા નાશકારક પાખડ–પજામાથી છૂટા થઇને સત્ય અને નીતિના પવિત્ર ધર્મમા જે કોઇ જાય, તે બધાને તમે આવી મા સામી નાગી ગાળ દેતા લજાઇને બૂડી મરતા નથી ? ખરા વર્ણસકર કોણ છે, એ તો ઉપર અમે તમને બગામગ પ્રમાણોસહિત સ્પષ્ટ બતાવીજ દીધુ છે–તે જોઇએ તો ફરીથી જોઇ લેજો

રાક્ષસોની ઓળખાણ !

મી ખાકી તમે, કહોછો તેમ આગલા જમાનાના દ્વાપરયુગમા રાક્ષસોની ઓળખાણ મુખની દુર્ગંધથી થતી હશે, પણ આ યુગમા તો મુખની અને કલમની વાણી ઉપરથીજ થાય છે– તમે અને તમારા સતપથે (સતપથના શાસ્ત્રોએ) જે નીચ વાણી અને નીચ નીતિરીતિ ધારણ કરી રાખેલી છે, તેજ ચોખુ બતાવી આપે છે કે ખરા રાક્ષસ કોણ છે ? મિયાભાઇ! લાબો વિચાર કર્યા પહેલા, પોતે હોઇએ, તેવાજ બીજાને ન જાણીએ અને ન કહીએ

ખાલી બકુકનો ખાલી ધડાકો !

મી૦ ખાકી, વળી તમે લખો છો કે "કુટણમુડી ખૂણે રવે" એ વાત તમારા આગલા ઇમામોનો બધો ઇતિહાસ વાચો, એટલે તરત તમને દીવા જેવી સમજાઇ જશે, કે કેટલી "કુટણમુડીઓને રડવાનો વખત આવ્યો હતો બાકી–" ખાલી બદુક પોતાની મેળે ફૂટી, જેથી અગ્નિ થઇ ચાર

realpatidar.com

https://archive.org/details/bk662/page/n15/mode/1up

realpatidar.com

પાચ માણુસો બળીને ભસ્મ થઇ ગયા ! " એવા હડહડતા ગપગોળા તો બાળકોને સંભળાવજો આ જમાનામાં તમારી એવી નીચ બનાવટોને કોઇ નહીં માને તમેજ ખાલી બંદુક ફોડી બતાવો અથવા તમારા પૂર્વજોની ટહાડાપોરે ચલાવેલી તોપોની પેઠે, લોખંડના તપાવેલા તવા ઉપર ચ્હડીને તમારી સત્યતાનો પરચો દેખાડી ખાત્રી કરી આપો, તોજ અમે માનીએ કે ખાલી બંદુક ફૂટી ખરી !

રાંડીરાંડના છાજીઆ !

મી૦ ખાકી વળી આગળ પોતાની જાત જણાવવાને લખે છે કે, વગરભરેલી ખાલી બંદુક પુણે ઉભી ઉભીજ ફુટે ! તેથી આગ લાગી ૪-૫ માણસોનો ભોગ લે ! એ શું ઓછું પ્રમાણ છે ! તેમજ તમો મૂવા, તમારા અહ્યા-કાળાં મોઢાં થયાં, અને વાયરો નીકળી ગયો ! " કોઇ રખડુ રાંડીરાંડની કે વંઠેલી પાતરની પેઠે આવી બાયલી ગાળો બોલવામાજ બાવામીયા ખાકીનું જ્ઞાન અને ડહાપણ પગલે પગલે ઉભરાઇ રહ્યું છે ધન્ય છે, ધર્મઢોંગીઓના કમનસીબ માતા પિતાને ! કે છેવટે તેમણે આવાજ રત્નો આ જગતમાં ઉત્પન્ન કર્યાં !

બરાબર જાત જણાવી !

છેવટે સતપંથનો ઢોલ પીટીને મી૦ ખાકી લખે છે કે,-" બિચારાને જવાબ દેતા ના આવડયો, જેથી ગાળો ભાંડીને પોતાનું ડોળ દેખાડી દીધું છે " બરાબર આ લખવા જેવુંજ ઉપર જણાવ્યા પ્રમાણે એ ખુરેલ ખટપટીઆ ખાકીએ કરી બતાવી જેનું ખાધું તેનું ખોદીને, ખાઇ બગાડયું છે અમારા લાંબા લેખોમાના એકેનો ઉત્તર તો આજસુધી હજુ નથી અપાયો,છતા રાંડની પેઠે છાજીયા લઇને ફોકટ છાતી તોડી નાખી છે, એનોજ અમને વધારે અફસોસ થાય છે

ખાકીનો ખરો ખુલાસો.

"અંધશ્રદ્ધાળુઓને યુકિતબાજો અને ધૂર્તો મળે છે; તેથી બેભાન બની સ્વધર્મનું ભાન ભૂલી, ધૂર્તના નાદ ઉપર મોહી પડી, પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે, ત્યાં સુધી કે ધર્મના અગ્રગણ્ય મહાપુરૂષોનાં વચનો ઉપરનો પ્રેમ ફેરવી, ધૂર્તોએ રમાડેલી રમત ઉપર દોરાઇ જાએ છે" ખજાનચે ખૂમી મી૦ ખાકી ! ઉપરના તમારા સોનેરી વચનો તો આબાદ તમારા સઘળા સતપંથ-પ્રવર્તકોને, સતપંથી કાકાઓ તેમજ સૈયદોને ઇંચે ઇંચ લાગુ પડે છે. આવા અંતરના સાચા ઉદ્‌ગારો બહાર કહાડી, પોતાના પાપોને ઉઘાડા પાડવા અને કબુલ કરવા માટે તમને ખરેખર ધન્યવાદ ઘટે છે ! ઘણું જીવો અને કુટિલતા કબૂલ કરતા રહો, બીજું તમને અમે શું કહીએ ?

છેવટની અરજ.

અંતમા લખવાનું કે, બાવા ઇમામશાહના નવા અવતારના ઢોંગધારી સૈયદ ખાકી ! મને તો તમારી ગાળો વાંચી-સાંભળીને હસવુંજ આવે છે કે, એ રીતે પણ તમારી ગલીચ વાણીથી તમેતો અમારા પાપજ ધોઇ રહ્યા છો, પણ મને એટલોજ ભય રહે છે કે, એ ગલીચ ગાળો ન સહન થવાથી, જો કોઇ બીજો ધર્મચુસ્ત હિંદુ તમારી બરાબર ખબર લેવાને બહાર પડશે, તો તમારા પીરાણાના પ્રપંચી પરચાઓનો મ્હોટો પહાડ પણ તમને બચાવી કે સંઘરી નહીજ શકે-માટે ગુન્હાની તોજેશ કરી, કરેલા કુકર્મોની માફી માગી, હજુ પણ બાકી રહેલી જીંદગીના મેલ-પાપ-ધોઇ નાખીને માલીકના વ્હાલા થાઓ અમે ઇચ્છીએ છીએ કે, ઇશ્વર તમને છેવટે સદ્‌બુદ્ધિ આપે.

લી૦ શત્રુમિત્ર સર્વનો હિતચિન્તક, સ્વધર્મ અને સ્વજ્ઞાતિને સમર્પિત

સેવક નારાયણજી રામજીભાઇ કોન્ટ્રેકટર.

realpatidar.com

(કચ્છવીરાણીવાળા) હાલ ઘાટકોપર (જીલ્લો થાણા)

realpatidar.com

પીરાણા "સતપંથ" નો રસીક અને રહસ્યભર્યો

મહાભારત ભેદી ઈતિહાસ !

હિન્દુભાઈઓને છળવા તેમજ વટલાવવાનું એક મહાન પ્રપંચી,

અને ભય કર કારસ્થાન !

પ્રિય હિંદુભાઇઓ ! આ વાંચો, ચેતો અને જાગૃત થાઓ !

પીરાણા સતપંથની પોલ !

કહેવાતા પીરાણા ઇમામશાહી કબ્રસ્તાની અર્ધદગ્ધ ખીચડીઆ સતપંથનો છૂપો ઈતિહાસ ! અનેક વરસોની મહેનત, અને શોધ–ખોળ, છૂપા ગુપ્તપણે પુસ્તકોના સાધન અને હજારોના ખર્ચે તૈયાર કરેલો એક અમૂલ્ય ભેદભરેલો મહાન્ ગ્રંથ ! અદ્‌ભુત વારતા, નવલકથા, નાટક, કાવ્ય કે ઇતિહાસના રસિક વૃતાંતો કરતા પણ વધારે રસીક, અદ્‌ભુત અને ભેદી બનાવોથી ભરપૂર ! સત્યઘટના, લિખિત પૂરાવા, શાસ્ત્રો અને કોર્ટના અનેક પ્રમાણો, તેમજ જાતિ અનુભવથી તૈયાર કરેલુ સુંદર સચિત્ર—નવુંજ પુસ્તક !

પીરાણા સતપંથનું વિચિત્ર પુરાણ !

જ્યારથી મહમદ ગીઝનીએ હિંદ ઉપર ચ્હડાઇ કરીને, હિંદુ મંદિરો, મૂર્તિઓ તેમજ આર્ય-ધર્મના નાશને માટે અત્યાચારની તલવાર ઉઠાવી, ત્યારથી આજસુધી એટલે લગભગ એક હજાર વરસો થયા હિંદુધર્મના અંતરજગતમા કેટલાક મતલબી સૈયદો, ફકીરો અને નામધારી પીરોએ કેવા કેવા પ્રપંચ–યુક્તિ–પ્રયુક્તિ અને દાવ–પેચથી, શામ–દામ–દંડ ભેદની–ચારધારી છલ–નીતિથી, હિંદુધર્મ અને હિંદુ–જાતિને નષ્ટ કરી, પોતાનો બનાવટી કપોળકલ્પિત પોકળ પંથ ફેલાવવાના ચમત્કારોની વાતો જોડવી છે, તેમજ સ્વર્ગ–ભેસ્તની લાલચો આપી ભોળા લોકોને લૂટી ખાવાને કામ કામ કેવા ઠગા-ઇના થાણા જમાવી, પોતાનો પાપી પેશો ચલાવવાના ગજબ જેવા મહાન ષડયંત્રો ગોઠવ્યા છે, તેનો રોમાંચક અને શબ્દે શબ્દ સાચો ભેદી ઇતિહાસ જો વાચવો હોય, તો આ એકજ પુસ્તક ખરીદો

ઇશ્વરી અવતારોની બનાવટી કથા !

એ નવીન હિંદુધર્મને નામે, વૈદિકધર્મનું એક કપોળકલ્પિત નામ ધારણ કરી, અરેબિયન નાઈટસના કિસ્સા જેવું ગપગોળાનુ બનાવટી ખોખુ ઉભુ કરીને, તેમા હિંદુ દેવદેવીઓ તથા બુદ્ધદેવને અને ઇસલામી ઇમામોને એક સાથે ગોઠવી દઇને, નુરસતગોર, પીરશમ્સ, પીર સદરદીન, કબી દીન ઇમામશાહ વગેરે પ્રપંચી પાત્રોએ રચેલી અદ્‌ભુત ઇંદ્રજાળ ! અમીની ગોળી, બાવાનો પ્રસાદ, પાવન કરનારો છાટો, ભેસ્તની કુંડી–સ્વર્ગની રજાચીઠી,–પીરાણાની જાત્રા, ગંગવો કુવો અને કાકા તેમજ મુખીઓની રસભરી અલબેલી રાસ–લીલા ! વગેરે વાચી વાચીને હસો.

નકલંકી અવતારની એક અદ્‌ભુત નવી રચના !

" હિંદુ પુરાણોમા જણાવેલો ઇશ્વરનો દશમો અવતાર, જે કલિયુગ પૂરો થયેથી થવાનો જણાવેલો છે, એતો અરબસ્તાનમા ઇમામ રૂપે પેદા થઇ પણ ચૂક્યો છે ! બ્રહ્મા, વિષ્ણુ અને શંકરે તો આ વખતે મ્લેચ્છના ઘરમા અવતારો લઇને નવી લીલા કરેલી છે !" એવી ઠગાઇનો રસીલો હેવાલ !

realpatidar.com

https://archive.org/details/bk662/page/n17/mode/1up

realpatidar.com

[illegible] કાર્યોની અદ્ભુત [illegible]!

પંજાબ-સિંધ-કચ્છ-ગુજરાત-ઉત્તરહિંદમા ઠેકઠેકાણે ખાના અને જમાતો સ્થાપીને, [illegible] અને ગુપ્ત રીતે સેવકોની ગતગંગા વહેવરાવી, ઘટ-પાટ-ગાયત્રી અને કલમા-નિમાજ તથા હેજ' ધંધા [illegible] કર્યું જેનો ખીચડો બનાવી, લાખો હિંદુભાઈઓની આંખે પ્રપંચના પાટાઓ લગાવીને, કેવી રીતે તેમને વટલાવવા તેમજ ઠગવામા આવે છે, અને દશોંદ વીશોંદ, ખુમ્સ, ખેરિયાત વગેરે બહાને, લાગા-લગવા-કર અને જમાતના લાકડાંઓ ઘુસાડી તેમને ખોટી લાલચે કેવી રીતે નીચોવી, નીચોવીને પાયમાલ કરવામા આવે છે, તેના અદ્ભુત પ્રસંગો, પ્રમાણો અને પરચાઓ વાંચો !

સૈયદોઓથી રાત્રે પાટ બીછાવી ભજવાતા આ નાટકનું, અંધારી દીવાલો વચ્ચે દટાઈ રહેલું અલભ્ય હજારો રૂપિયા ખર્ચતા પણ મળી ન શકે એવું, સંપૂર્ણ સાહિત્ય ' મહોર, નગુવત, રોઝા રૂપી [illegible] ઘોડાના સુંદર સમરંગી ચિત્રો અને તેમનો ભેદી ઇતિહાસ ! નુરનામુ, બાજનામુ-[illegible]નામું અનાદેઅલી, પીરશાહનો પાઠ, તેયઅનો કલમો, દશ અવતાર, ક્રિયાઓ, ઘટ-પાટ, બુદ્ધાવતાર, મૂલબંધ, દશતરી ગાયત્રી, બનાવટી સંધ્યા વગેરે અનેક ગોઠવી [illegible]લાં વિચિત્ર ગ્રંથોના ગોકડાથી ઉભા કરેલા, પીરાણા સતપંથ, નકલંકી, ગુપ્તપંથ, વગેરે અનેક છુપા ધર્મોનો સીલસીલાબંધ મહત્વનો મહાભારત ઐતિહાસિક ભેદી ગ્રંથ !

આ એકજ ગ્રંથ વાંચવાથી હિંદુધર્મને અનેક રીતે હાનિ પહોંચાડનાર, અને ભોળા હિંદુ-[illegible]ઓને મહાન્ પ્રપંચોથી ફોસલાવી, લલચાવી-પ્રપંચજાળમા પકડી, વટાળીને ભ્રષ્ટ કરી, ધન-ધર્મ જાતિ તેમજ સન્માનનું પણ હરણ કરી, હિંદુધર્મના દુશ્મન બનાવનારા, કરપીણ કારખાનાઓની કુટિલ કળાઓનો તાદૃશ્ય ચિતાર આપો સામે ખડો થશે !

દુનિયાની સપાટી ઉપર અનેક ધર્માઓને ઠગાઇથી વટલાવવા માટે કેટલાક મહાન્ ભેજામાથી ઉપજાવેલું એક પ્રત્યક્ષ બહેસ્ત (ભેસ્ત), તેના ભેદ-ભરમો અને ભોગવિલાસના પ્રપંચ પડદાઓ !

ઉપરના બધા ધર્મોની ઉત્પત્તિ અને આજસુધીની સ્થિતિ, તથા જન્મથી મરણપર્યંત એ ધર્મના સેવકો અને અનુયાયીઓને કરવાની ક્રિયાઓ તેમજ જગતને ઉંધે રસ્તે ચડાવવાની યુક્તિઓ, હિન્દૂઓને ધર્મદ્રોહી, દેવદ્રોહી જ્ઞાતિ અને દેશદ્રોહી બનાવનારી એક ભીષણ જાળ ! ખાના કે રૂહની કતલગાહ' તેના અદ્ભુત પરચાઓના રદીઆ અને સતપંથની ખામીઓ વિગેરે અનેક કલિલીલાઓનો અદ્ભુત ચિત્રપટ '-તેમજ કાકા' અને મુખીઓના જુલમ-દુરાચાર તેમજ પ્રપંચોનું પોગળ, વાંચી વાંચીને તમો જરૂર અજબ બની જશો આ પુસ્તકનું કદ રૉયલ આઠ પેજી (મ્હોટા પાના) લગભગ ચારસો થશે. ગ્લેઝડ ચીકણા કાગળ, સુંદર ચિત્રો, જંતર-મંતર અને વંશાવળીના કોઠાઓ, પ સોનેરી પૂંઠું અને સવિસ્તર ભૂમિકા તેમજ અનુક્રમણિકા આ મહાન ગ્રંથ હજારોના ખર્ચે તૈયાર કરેલો હોવા છતા, ધર્મસેવા અને જાતિસેવાના હેતુથી તેની પડત કિંમત ફક્ત રૂા ૩) રાખુજ રા[ખ]વામા આવી છે થોડાજ વખતમા બહાર પડશે ! અગાઉથી ગ્રાહકો થઇ પૈસા ભરનારને પો[સ્ટ] વી. પી ખર્ચ માફ. જલ્દી નામો નોંધાવો-ગ્રાહક પૂરતાજ પુસ્તકો છપાતા હોવાથી, પછી [illegible] નહીં મળી શકે, તો પસ્તાવું પડશે

લખો-પટેલ નારાયણજી રામજીભાઈ કોન્ટ્રેક્ટર.

કચ્છ વીરાણીવાળા-હાલ ઘાટકોપર. (જીલ્લો થાણા

realpatidar.com